

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રમ્પટન મેયરના COVID-19 સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સની (Seniors Support Task Force) જાહેરાત કરે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (18 માર્ચ 2020) – આજે સિટી ઓફ બ્રમ્પટનને તેમનું ત્રીજું ફક્ત વરિષ્ઠો માટેનું વિશિષ્ટ કાર્ય દળ ઊભું કર્યાની જાહેરાત કરી છે જે સ્થાનિક અર્થતંત્ર અને નબળા સમાજોને ટેકો મળી શકે: મેયરનો COVID-19 સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ.

પેટ ફોર્ટિની રીજનલ કાઉન્સિલર વોર્ડ 7 અને 8 અને રીજનલ કાઉન્સિલર ગુરપ્રીત ધિલ્લોન, વોર્ડ 9 અને 10નાં સહ પ્રમુખપદે આ વિશેષ ટીમ બ્રમ્પટનના વરિષ્ઠ નાગરિકોને આવા સમયે સૌથી વધુ આવશ્યક હોય એવી માહિતી અને સંસાધનો પહોંચાડવા અંગે સંકલન કરશે.

આ જૂથ સિટી ઓફ બ્રમ્પટન ઈમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર અને સિટીના સ્ટાફ સાથે મળીને કામ કરશે જેઓ COVID-19ને માત આપવા માટેના અસરકારક પ્રતિભાવનું વ્યવસ્થાપન કરે છે.

આજની જાહેરાત મેયરના COVID-19 ઈકોનોમિક સપોર્ટ એન્ડ રિકવરી અને સોશ્યલ સપોર્ટ ટાસ્ક ફોર્સિસની ગઈ કાલે થયેલ પ્રારંભના પગલે થઈ છે. આ અંગે વધુ માહિતી [અહીં](#) વાંચો.

અમારી સાથે જોડાવ

જે વ્યક્તિઓ સિટીના COVID-19 રાહત કાર્યોમાં મદદરૂપ થવા પોતાનો ફાળો આપવા તત્પર હોય તેઓ અમને ઈમેલ દ્વારા સંપર્ક કરી શકે છે.

- મેયરનો COVID-19 ઈકોનોમિક સપોર્ટ એન્ડ રિલિફ ટાસ્ક ફોર્સ-Covid19business@brampton.ca
- મેયરનો COVID-19 સોશ્યલ સપોર્ટ ટાસ્ક ફોર્સ-Covid19support@brampton.ca
- મેયરનો COVID-19 સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ-Covid19seniors@brampton.ca

વધુ માહિતી

સિટીની સેવાઓ અને બંધ રહેલ સવલતો અને પ્રોગ્રામિંગ વિશે બિલકુલ તાજેતરના અપડેટ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) માટે અહીં www.brampton.ca/covid19ની મુલાકાત લેવા વિનંતી છે.

પીલ પબ્લિક હેલ્થ પરથી બિલકુલ અદ્યતન માહિતી માટે મુલાકાત લો: www.peelregion.ca/coronavirus.

અવતરણ

"હાલમાં જ્યારે બ્રેમ્પટનવાસીઓ અને કર્મચારીઓની સુરક્ષિત રાખવામાં દૈનિક થવા સિટી હોલ બંધ છે ત્યારે કાઉન્સિલે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું છે જેથી અમે સ્થાનિક અર્થતંત્ર અને નબળા સમુદાયોને ટેકો આપવા માટે ખાતરીપૂર્વક સહયોગ આપી શકીએ. આ નવો ટાસ્કફોર્સ સુનિશ્ચિત કરશે કે અમે બ્રેમ્પટનના વરિષ્ઠોને ગ્રોસરી ખરીદવામાં અને દવાના પિક અપ માટે સહાયતા કરીને તેમની કાળજી લઈએ. અમારા હિસ્સાધારકો સાથે મળીને અ COVID-19નો પ્રભાવ ઓછામાં ઓછો રહે તે માટે પ્રતિબદ્ધ છીએ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca